



RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHRI CHIMANBHAI PATEL VIRAS BHAVAN, POST BOX NO 238, JAMHAGAR ROAD, RAJKOT

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટીફિકેટ/વિ.પુ.વિ.ચો./૨૦૩૧/૩૯૦૫

તા.૨૬-૦૯-૨૦૧૯

પ્રતિ

રાજ એન્ટરપ્રાઇઝ

૮/૦ દિપક કગથરા (કન્સલ્ટીંગ સીવીલ એન્જીનીયર)

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૨૧-૦૯-૨૦૧૯ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- નાનામવા તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ૨૧ પેકી અંતિમ ખંડ નં.- ૩/૧/૨ પ્લોટ નં.- ૧૮ થી ૨૦ ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોનમાં સુચિત કરાયેલ છે. અને સર્વે નંબરની ઉત્તરે દરખાસ્તો પસાર થાય છે.

સદરજૂ જમીન મોજે - નાનામવા ની ટી.પી. સ્કીમ નં.- ૭ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

આ સંબંધે:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે, વિકાસ/ખાંધકામની પરવાનગી નથી.

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
રાજકોટ


RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY-RUDA



PART PLAN OF

SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act, 1976
Vide U.D. & U.H. Department Notification No. GHV/192 of 2016 /DVP-13-2016-223702-L, Dated 27-10-2016.
Sanctioned Variation in the Second Revised Development Plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)
under Government Notification of Urban Development & Urban Housing Department
No. GHV/276 of 2017 /DVP-132017-725-L, Dated 13-10-2017 & It's Corrigendum No. GHV/296 of 2017 /DVP-132017-725-L, Dated 24-10-2017.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.
NOTE : This Part Plan can not be used for making any entry in revenue records and can not be Considered as
Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY NO.: 21

VILLAGE : NANA MAVA

TALUKA : RAJKOT

T.P.S. NO. : 7

F.P. NO. :

Prepared By :

Checked By :

DATE : 25-SEP-2019

LEGEND

- Residential Zone
- Existing Road
- TPS Boundary



SCALE = 1 CM. = 80 MT.

TRUE COPY

JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT